

GMM/SEC/2022-23/37

August 26, 2022

To,

BSE Limited

Phiroze Jeejeebhoy Towers, 1st Floor, Dalal Street, Mumbai - 400 001

Scrip Code: 505255

NSE Limited

Exchange Plaza, C-1, Block G, Bandra Kurla Complex, Bandra (E) Mumbai - 400 051

Symbol: GMMPFAUDLR

Dear Sir,

Sub: Compliance under Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations")

Pursuant to Regulation 30 of the Listing Regulations, we hereby enclose copies of the Notice issued for the attention of the shareholders in respect of information regarding 59th Annual General Meeting scheduled to be held on Monday, September 19, 2022 through Video Conferencing/ Other Audio Visual Means, in compliance with the Ministry of Corporate Affairs General Circular No. 20/2020 dated May 5, 2020. The notice was published in Economic Times, Mumbai Edition and in Naya Padkar, Anand Edition on August 26, 2022.

Kindly take the same on record and acknowledge receipt of the same.

Thanking you,

Yours faithfully,

For **GMM PFAUDLER LIMITED**

Mittal Mehta

Company Secretary & Compliance Officer

FCS No.: 7848 Encl: As above

GMM Pfaudler Ltd.

Corporate Office: 902 VIOS Tower, New Cuffe Parade, Sewri-Chembur Rd, Mumbai 400037 Registered Office & Works: Vithal Udyognagar, Anand - Sojitra Road, Karamsad - 388325 O: +91 22 6650 3900 | F: +91 2692 661888 | CIN: L29199GJ1962PLC001171 W: www.gmmpfaudler.com | E: sales@gmmpfaudler.com















20

48

47

46

45

44 3

35

33

32

8

58

28 27

26

25

23

20

9

4

13

'Will Study Benami Ruling by SC; Close Watch on Online Gaming'

COLLECTIONS SOAR Gross tax collection at ₹5.73 L cr; ₹93,000-crore refunds issued

Anuradha.Shukla

elimesgroup.com

New Delhi: The government will examine the Supreme Court decision that the Benami property amendment law cannot be applied prospectively chairman of the Central Board chairman of the Central Board Captanian of the Central Board Captanian of the Central Board Captanian of the Central Captanian of the Samurhorities will be closely watching the online gaming sector for any instance of tax evasion, Gupta said.

The decision to keep a close watch on the online gaming segment follows a crackdown on a Mumbal-based online gaming segment follows a crackdown on a Mumbal-based online gaming segment follows a crackdown on a found 80 lakh players were registered on the gaming portal and detected gross earnings to the tune of ₹58,000 crore over the tune of ₹58,000 crore over the state of \$60,000 crore over the state ove



The net tax collection (as on Aug 24) is up 33% against the previous financial year despite the refunds, which are 78% more. The gross collection is up by 39% Nitth Gupta

Robust Mop-up

rate of 30% and there is nodeduc-tion or refund for earnings from lottery or gaming or betting. "We have to see how we can get data in a structured manner... A policy call will have to be taken on it." Gupta said in an interaction with select media persons. "Asked about the banking repre-sentations on the application of a reversal factor of the service of the reversal for the service of the service of the work of the service of the service of the work of the service of the service of the work of the service of the service of the work of the service of the service of the work of the service of the act, learing tract the newly into-duced provision will force them to deduct a 10% tax at source on in-centives extended to large busi-ness customers via credit cards. They also sought clarification if it will be applicable on loans wai-ved through one-time settlement. According to Section 194R, in troduced in the budget this year any person providing a resident a any person providing a resident a benefit or perquisite arising from a business will ensure that tax has been deducted at the rate of 10% of the value of the benefit orperquisite, with effect from Ju-ly L. "We will issue a clarification

ROBUST COLLECTIONS
Gupta said that the income tax collection continued to be robust. "The net tax collection (as on August 24th) is up 33% against the previous financial year despite the refunds, which are 78% more. The gross collection is up by 39%, "Gupta added.

The gross tax collection was \$5.73 lakh and \$95,000 crore redunds were Issued. Corporate tax growth is around 24% while personal income tax is up 42%. Better compliance and early filing of returns and better data in the Annual Information Statement contributed to the growth, Guptasaid. He added that the new feature this year was the provision of updated return and about one lakh returns have been filled, amounting to 250 crore in tax.

FOR FULL REPORT, GO TO

Job Creation in June Highest in FY23 So Far

ESIC recorded 2.67%

new jobs

New Delhi: Formal job creation

New Delhi: Formal Job creation reached the highest level sofar in this financial year in Juriea at the Employees Provident Fund Organisation (EPFO) and the Employees State Insufficient (EPFO) and the Employees State Insufficient Pension Scheme (NFS) saw a decline compared to the previous month of the Compared to the previous month of the Statistics and programme implementation ministry on Thursday showed net new subscriber additions under the EPFO increased 444% to L88 million in June compared to 1.47 million in May Net new subscribers under the ESFC increased 2.87% to 1.58 million in June Pension State (1.58 million in June 1.58 m

യ്ക്ക് Companies say power

sector doleouts a key

reason for NPAs and

poor state finances

Sarita.Singh@timesgroup.com

New Delhi: Private power generators have filed for intervention in the Supreme Court in an ongoing matter on issues related to election freebies. The writ petition filed by the Association of Power Producers (APP) sought the court's intervention "in the financially cripiling crisis faced on account of the untrammeted resort to popular schemes and unjustified freebies be a common to the country of the country

litical parties giving or promising free bies to induce voters before elections. Considering the chief justice N V Ra

India's Next Executive

K Subramanian is

Director at IMF

Power Gencos Seek to Join

Debate in SC Over Freebies

On the Rise

Net new jobs up EPFO and ESIC highest in June with 1.83

48.1% jump compared to 1.04 million enrol-ments in June last year. Enrolments under the NPS, however, were higher at 78,265 a year

ago.
Out of the total 1.83 million net subscribers
added to the EPFO in June, about 1.05 million
new members were enrolled under the social
security cover of EPF & MP Act, 1852 for the
first time, as per the data.

About 17 million net subscribers exited but re-joined the EPFO by transferring their accumulations from the previous provident fund accounts to the current PF accounts, in fund accounts to the current PF accounts, in fund accounts to the current PF accounts, in fund account of the provident fund account of the STPO. As per the report, 12 smillion male subscribers and 0.28 female subscribers were added to the ESIC in June. Under the NPS, the highest number of subscribers added in June was at the state government (evel (29,800), followed by addition under the corporate sector (20,800), while the least were added by the central government (7,383). The National Statistical Office report is based on the payroll data of new subscribers of various social security schemes run by the ESIC, the EPFO and the Pension Fund Regulatory and Development Authority it has be

April 2018, covering the period starting from September 2017.

The report said since the number of sub-scribers is from various sources, there are elements of overlap and the estimates are not

All Fertiliser Cos Told to Sell

Products under 'Bharat' Brand

PM: WFH can **Boost Women** Labour Force

'Flexible work ecosystems are the need of the future'

New Delhi: Prime Minister Narendra Modi Thursday called for flexible workplaces, work from home and flexi work hoursast the need of the future that can help increase the women facur force participation in the country. "The country's labor ministry is preparing its vision for the year "394" in Amritkal. Flexible workplaces, work from home-cosystem and flex-iwork hours is the need of the future. We can use systems like lexible workplaces opportunities. workplaces, work rom nomecocystem and tieswork hours is the need of the future. We can use
systems like flexible workplaces as opportunities
for women labor force participation, "PM Modi
said while virtually addressing the twoday National Labour Conference at resulting the twoday
Hailing the successory of the stream portal, PM
Modi urged the states to integrate their state portals, with the e-Shram portal, PM
with the e-Shram portal, PM
with open new opportunities for all the workers
of the country while the state
set will get more benefits of
the country while the state
the volumity's labor force,"
PM Modi said. Thee-Shram
portal has nealy 28 crore
unorganised workers who are getting the benefit
of facilities like Universal Account Number and
enhanced employment opportunities as the government links it with the National Caver-Service portal. Ascen portal and Udyam portal.
The Centre along with labour ministers and labour secretaries of alstates will deliberate at the
National Labour Conference to firm up Vision

bour secretaries of all states will deliberate at the National Labour Conference to firm up Vision 2947 for India's workforce while working out on modalities for India's workforce while working out on modalities for India's workforce while habour codes and roping in states to integrate their social security scheme one Shram portal.

Referring to the labour reforms through amalgamation of 29 abour laws into four Labour Codes, PM Modi said there is a need to take quick decisions in the rapid changing wordt. "The world is changing rapidly. If we do not prepare ourselves fast, then there will be a danger of falling behind," he said.

"India was left behind in taking advantage of "alling behind," he said.

ves inst, then there will be a langer or inlining behind," he said.
"India was left behind in taking advantage of the first, second and third industrial revolutions. Now at the third industrial revolution, decisions will have to be taken fast and they will also have to be implemented fast," he added.

Registered Office: Vitalian of the said investorser.

NAA Investigating 250 Retailers for 'Profiteering'

Anuradha.Shukla

Retimesgroup.com

New Delhi: The National Antiprofiteering Authority (NAA)
is "internally" investigating
around 250 retailers following
complaints that they raised
prices of pre-packaged items,
more than warranted, following the imposition of goods
and services tax (GST) post the
July Bechanges in rates.

"We have received many
complaints both from customers and field formulations
about instances of jump in cost
of pre-packaged foods," a person aware of the developments
son aware of the developments
on aware of the developments
as the person cited above said
that apart from pre-packaged
items, there are also complaints
about retailers charging
more even on large packs,
which are otherwise exempted
from tax.

This wasdespite the Centre gi-

from tax.
This was despite the Centre giving a detailed clarification regarding new GST rates, which said that items sold in loose will be exempted from GST.

Under Scanner

The Central Board of Indirect Taxes and Customs is closely monitoring the implementation of GST rate changes which was applicable on com-mon items including curd and lassi.

which was applicable on common items including curd and alassi.
"The rules were notified clearing all ambiguities, still if the retailers are missing it, strict action will be initiated against them," the person cited about said adding that while increase and the said and the s

Open E-Tender Notice No. KYN-LD-585-W-731-Cont

With Loses W 33 Local
Mane of work 1 Supply and exection of OHE bonds in connection with various CTTR, TRR, TSR & TTR works in Kelyan & Lorewals Districts of Mumbal Selection of Mumbal Selection (1) Control of Selection (2) Cest of Tender Form: 1000, Completion period : 12 months. The time and date for submission of leader will be up to 11 100 Extender are available at official Railway website www.freps.gov.in. The complete documents can be checked as a selection of the control of tender are available at official Railway website www.freps.gov.in. The complete documents can be worked to the control of tender is a variable to on the Notice Board of the SciDE(TO) KYNS office, Kalyan. 412
RailMandad Heighline 130

केनरा बैंक Canara Bank 📣

M&C Section, M&PR Wing, Head Office Annexe, Ground Floor, d Cross, Gandhinagar, Bengaluru - 590 00 2nd Coss, Gandhrage, Bengsturv. 590.009
Chanara Bank, ladding Public Sector
Bank, invites sealed tender for
Engagement of Public Relations
Agency for the Bank. Interested
bidders are requested to submit
their bid on or before 15.09.2022
(Thursday) by 12:00 Noon. For
further details, log on to our website
www.canarabank.com/Tenders and
CPP portali.e. www.eprocure.gov.in
Des - 200.00220. Date : 26.08.2022 Sd/-Place : Bengaluru Deputy General Manage

-GMM Pfaudler ' **GMM PFAUDLER LIMITED**

CIN: L29199CJ1962PLC001171

Registered Office: Vithal Udyognagar, Anand-Sojitra Road, Karamsad–388325, Gujarat Phone No. 2692-661080

Email: investorservices@gmmpfaudler.com • Website: www.gmmpfaudler.com information REGARDING THE 59" ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCE (VC) OTHER AUDIO VISUAL MEANS (OAVM)

THROUGH VIDEO CONFERENCE (VC) OTHER AUDIO VISUAL MEANS (OAVM) Shareholders may note that the 59° Annual General Meeting ("AGM") of the Members of GMM Pfaudler Limited ("the Company") will be held through VC/OAVM on Monday, September 19, 2022 at 12,00 noon IST, in compliance with the applicable provisions of the Companies Act, 2013 and Rules issued thereunder and the Securities and Exchange Board of India (SEBI) Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with the Ministry of Corporate Affairs (MCA) General Circular No. 20/2020 dated May 5, 2020 and No. 2/2022 dated May 56, 2022 & Circular dated May 13, 2022 issued by SEBI, along with such other applicable circular sissued by MCA and SEBI (hereinafter referred to as MCA Circular & SEBI Circular respectively), to transact the business set forth in the Notice of the AGM.

Dusiness set forn in the votice of the AGM.

In compliance with the above referred Circulars, the electronic copies of the Notice of the 59° AGM and Annual Report for the financial year 2021-22 will be sent to all the shareholders whose e-mail addressess are registered with the Company! Depository Participants. The Notice of the 59° AGM will be available on the Company's website www.mmpfaudler.com and on the website of the Stock Exchanges, BSE Limited at www.bseindia.com and on the website of Link Intime India Pvt. Ltd. at https://instavote.linkintime.co.in.

Manner of registering/ updating e-mail addresses:

- Members holding shares in physical mode who have still not registered their e-mail ID with the Company can temporarily get their e-mail IDs registered with the Company's Registrar and Share Transfer Agents, Link Intime India Put. Lid., (hereinafter referred to as "Link Intime") by using the link: https://web.linkintime.co.in / EmailReg / Email Register they. Email Register.html
- Members holding shares in dematerialized mode are requested to register/ updatheir e-mail addresses with their relevant Depository Participants.

Manner of voting at the AGM:

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its shareholders to cast their votes on all resolutions set out in the Notice of the AGM. Shareholders have the option to cast their vote on any of the resolutions using the remote e-voting facility or e-voting during the AGM. Detailed procedure for remote e-voting/e-voting during the AGM will be Notice of the AGM.

Payment of Dividend:

- ment of Dividend:

 Shareholders may note that the Board of Directors of the Company at their meeting held on May 25, 2022, had considered and recommended payment of final dividend offiNR1.00- (Rupee one only) each per equity share respectively paid on 4,38,52.50 (Rupees Four Corres Thisty, Eloh Calulty Shares, aggregating to INR 4,38,52.500 (Rupees Four Corres Thisty, Eloh Lakhs Fifty Two Thousand Five Hundred only)(post-bonus) subject to the approval of shareholders at the ensuing 55° AGM. The final dividend, if approved by the shareholders will be paid on or before Monday, October 17, 2022, to the shareholders whose name appears in the Register of Members as on the Record date i.e. Monday, September 12, 2022. The final dividend will be paid electronically through various online transfer modes to those shareholders who have updated their bank account details. For shareholders who have not updated their bank account details, dividend warrants will be sent to their registered addresses.

 As shareholders must be aware, as per the Income Tax Act, 1961. as amended hy the
- As shareholders must be aware, as per the Income Tax Act, 1961, as amended by the Financa Act 2020, dividends paid or distributed by the Company after April 1, 2020, shall be taxable in the hands of the shareholders and the Company shall be required to deduct tax at source (TDS) at the prescribed rates from the dividend. The TDS rate would vary depending on the residential status of the shareholders and documents submitted by them and accepted by the Company. Accordingly, the final dividend will be paid after deducting TDS as explained therein.

 Shareholders are projected to submit the degree of the company.

Shareholders are requested to submit the documents in accordance with the applicable provisions of the Income Tax Act, 1961. The detailed tax rates, documents required for availing the applicable tax rates will be provided in the notice of the AGM.

nner of registering/ updating bank details:

Place : Mumbai Date : August 25, 2022

- Shareholders holding shares in dematerialized mode are requested to register complete bank account details with their respective Depository Participants.
- complete bank account details with their respective Depository Participants. Shareholders holding shares in physical mode and who have not registered their bank details can get the same registered with Link Intime India Pvt Ltd, by clicking the link: https://webp.linkintime.co.in/EmailRegisterfmail. Register.html or on their website www.linkintime.co.in at the Investor Services tab by choosing the e-mail/Bank Registration heading and follow the registration process as guided therein. In case of any query, a member may send an e-mail to RTAst mt.helpdesk@linkintime.co.in.

27 28

above information is being issued for the information and benefit of all the eholders of the Company and under the Circular(s)issued by the MCA and SEBI.

For GMM Pfaudler Limited

29 30 31 32

Sd/-Mittal Mehta Company Secretary & Compliance Officer

Its tofarmers. Logo of Pradhan Mantri Bhartisidan executive of another firm. Cabinet Restricts Exports of Wheat Flour to Check Prices

Decision will destroy

farmer engagement,

Shambhavi.Anand

wumesgroup.com

New Delhi: The Centre has directed all fertiliser companies in the country to self their products un move that companies said will destroy their branding and reduce their engagement with farmers.

All fertiliser bags, whether containing urea, diammonium phosphate (DAP), NPK, or muriator for their production of their production o

feel fertiliser firms

their branding, reduce

mana is retiring today, the court observed that the matter will be referred to be presided by Justice D Y Chanrdschud who will take up the batch matters, sources said. The pace court and on Wednesday as The pace court and on Wednesday as the pace court and power monet, why it can't call an all-party meeting and discuss the freebles matter. The court is hearing a PIL by advocate Ashwini Kumar Upadhyay seeking directions to the Centre and the Election Commission of India to take steps to prevent the practice of political parties giving or promising freebles to induce voters or promising freebles to induce voters or promising freebles consisting of "free electricity reduced rate of electricity" being promised by various political parties by way of their Election Manifestos across States unleashing an unhealthy competi-

New Delhi i Pune: India on Thursday decided to restrict wheat flour exports to check rising prices in the domestic market and ensure food security. The Cabinet Committee on Economic Affairs (CCEA, which met under the chairmanship of Prime Minister Narendra Modi, approved a proposal to amend the policy of exemption for where at or meslin flour from export restrictions' ban, an official statement said. The Directorate General of Foreign Trade (DGPT) will issue a notification to this effect, it said.

"Earlier, there was a policy not prohibil to put any restrictions to a chairmanship of Prime Minister Narendra Modi, approved a proposal is
mend the policy of exemption for whe
mend the policy of exemption for whe
mend the policy of exemption for whe
exemption from ban/restricthe policy was required to withdraw
and put a check on mounting prices
of providing the action of the exemption from ban/restricthe policy was required to withdraw
and put a check on mounting prices
and flow and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow in the policy was required to withdraw
and put a check on mounting prices
and flow in the policy was required to withdraw
and put a check on mounting put a check on mounting prices
and flow in the put a check on m



Big Food Cos Start Selling Wheat Stocks to Flour Millers

ya Janurvarak Pariyojana (PMBJP) will also have to be displayed on the bags, the government order said.

PMBJP is the scheme under which the central government gi-ves subsidies annually.

Fortiliser companies said this will deal to a memory and on the same of the company's name will become very small sa most of the space on the bag will becoccupied by the said logo," anoficial at a fertiliser company said on condition of anonymity.

Fertiliser firms carry out several activities such as demonstrations and crop surveys on farms to help build a recall value among farmers. There will be no point in doing those if the brand name of the company can't be displayed prominently.

New Delhi Big food companies suchas ITC. Viterra and Britannia, which were holding on to their wheat stocks after the government banned export of the grain, have started selling them to millers, according to traders, pushing up the cereal's availability in the domestic market, reports Shambhavi Anand.

"We are liquidating some of the wheat Iying at the eastern ports, such as Kakinada and Krishnapatnam," said a senior executive of a large wheat exporting company, re-

New Delhi: Former chief economic adviser Krishnamurthy Subramanian was on Thursday appointed as executive director (India) at the International Monetary Fund, a personnel denarment order said. Subramanian is currently professor The Appointments Committee of the Cabinet has approved the appointment of Subramanian to the post of ED (India) at IMF, with effect from November 1, 2822, for a period of three years or until further orders. He will replace Surjit Shallad whose three-year renure as ED (India), IMF, has been curtailed by nine days to end on October 31, 2022. — Our Bureau RBI, Banks in Talks to Strengthen KYC Identification Format

Dheeraj.Tiwari@timesgroup.com

New Delhi: Banks are in discussion with the Reserve Bank to further strengthen the central know your customer (CKYC) format in order to avoid multiple accounts in the banking system with different KYC identification. At present, any one of the six documents—passport, Andhaur, voteriedentily card, NRE GA card, PAN card the control of t

Curbs on Multiple Accounts

address to open a hank account.
A senior bank executive told ET that meeting in this repart was held ast week with officials from RBI.

"The issue is that it becomes difficult to trace multiple accounts of an individual if they are not linked and are opened with different KVC documents," said the above quoted executive. "It is being discussed if we can collare information of existing accounts and a common format can be developed to address this going forward," the person said.

Another executive aware of the developments said that the plan is to further strengthen the central KYC Record Registry, which can be accessed by entities operating under all four major regulators of the financial sector—RBI, market regulator Securities and Exchange Board of India, insurance regulator Irdia and pension watchlog PFRDA.

CKPC is a 1-digit number and once an individual gets this KYC identification number or KIN, it can be used acrossallfinancial services providers.

કઠલાલના ભાનેર ખાતે હરમો વન મહોત્સવ ચોજાચો



કઠલાલ તાલકાના ભાનેર ખાતે ૭૩ મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો.વનીકરણ વિભાગ દ્વાર ચાલુ વર્ષે ૭૦ હજાર જેટલા રોપવાનું વાવેતર કરવામાં આવ્યું તેમજ પાંચ લાખ રોપા વાવવા માટે આપવામાં આવ્યા.તથા ચાલુ વર્ષે વન વિભાગની વનીકરણની હરાજીની ૭૫ ટકા રકમ એટલે કે આશરે ૨૬ લાખ ૬૪ હજાર જેટલી રકમનો ચેક ભાનેર ગ્રામ પંચાયતને વિકાસના કામો માટે આપવામાં આવ્યો. તથા ૧૬ હજાર જેટલા વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા. આ પ્રસંગે કઠલાલ પંચકના ઘારાસભ્ય કાળુસિંહ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પરમાર, ખેડા જીલા ભાજપ મંત્રી રાજેશભાઈ પટેલ, ગ્રામ પંચાયત સરપંચ સુધાબેન, આર એક ઓ આશાબેન તેમજ ટિમ્બર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ,મંત્રી તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ શાળાના આચાર્ય સહિત સ્ટાક અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સ. ૫. યુનિ.ના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલી આઉટડોર કુલિંગ સિસ્ટમ લોકોને ઠંડક આપશે

સરદાર પટેલ યુનિવર્સિટી દ્રારા સંચાલિત અને ગુજકોસ્ટ દ્રારા અનુદાનિત આણંદ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રમાં વિદ્યાર્થીઓ દ્વારા ૦૫૧ત૦૦' કુર્લિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. ફોગર, કંટ્રોલર અને તટ મોટરનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ મોનાર્થ પટેલ અને કુ. ચાંદની સરગરાએ પોતે કેન્દ્રના માનદ નિયામક ડો. વિભાબેન વૈષ્ણવના માર્ગદર્શનમાં વિકસાવેલ આ કુલિંગ સિસ્ટમનો ગાર્ડનમાં, મંકાનની બારીમાં બહારની બાજુએ, અગાશીમાં કરવાથી ઠંડક તો થાય છે સાથે હવાના પ્રદુષણની અસર પણ ઓછી થાય છે. ખાસ ગાય-ભેંસ, અને પાણીના તબેલામાં રાખવાથી પ્રાણીઓને ઠંડક થાય છે. ગાય ભેંસની તો દૂધ ઉત્પાદન ક્ષમતા



પણ વધે છે. આ સિસ્ટમ ટાઈમરથી ઓટોમેટીક ચાલતી હોવાથી વાપરવામાં સરળતા રહે છે. ઘણા ઓછા પાણી અને ઇલેક્ટ્રિસીટી વપરાશથી કુદરતી ઠંડકનો અનુભવ કરી શકાય છે.

આ સિસ્ટમ લોક વિજ્ઞાન કેન્દ્રમાં ડેમોન્સ્ટ્રેશન માટે મકવામાં આવી છે. સહને જોવા આવવા આમંત્રણ છે. ચોમાસુ જાય અને ઓતરા-ચિતરાના

તડકામાં સહને આવી કદરતી ઠંડક માણવા આ ઉપયોગ કરવા વિનંતી છે. લોક વિજ્ઞાન કેન્દ્રમાં ઓર્ડર પ્રમાણે બનાવી આપવામાં આવશે

સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રોફે.નિરંજનભાઈ પટેલે યુનિવર્સિટી એ દત્તક લીધેલા રવિપુરા ગામમાં આ સીસ્ટમ ઈન્સ્ટોલ કરાવવાનું શરૂ કર્યું છે.

રજાઇનામાં સંગીત સવારનો કાર્યક્રમ યોજાયો

Our Own Gujarati Senior Citizen Friends Circle , Regina (5-28 નેશનલ વોટસઅપ ગુપ) બે વર્ષ પર્ણ કરી ત્રીજ વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે ઓનલાઇન સંગીત સવારનો મન મોહક સરસ કાર્યક્રમ યોજાયો. આ ગૃપની શરૂઆત વર્લ્ડ સિનિયર સિટીઝન ડે એ થઈ. અત્યાર સુધી પદ ઓનલાઇન વિવિધ વિષય પર આઘારિત મિટીંગ થઈ છે. ગૃપ માં કુલ ૧૦૦થી વધુ ગાણિતિક પઝલ મૂકાઈ છે વિવિધ ૧૦ થી વધુ નવીનતમ સ્પર્ધા કરી છે . જેમાં સિનિયરો



ગૃપ નું પોતાનું દ્રિમાસિક સામાયિક પદ્રષ્ટિ પ પણ છે. જાઈના ઉપરાંત કેનેડા ના વિવિધ શહેરો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમજ ગુજરાત ના વિવિધ શહેરો માંથી વિનામૂલ્યે સભ્યો નોંધાયેલ છે . સદર સંગીત સવાર નો કાર્યક્રમ જી. એન .ભાવસાર (વોઇસ ઓફ મહેશ), વિદ્યાનગર અને કરાઓક

બાકરોલના સહકાર યોજવામાં આવેલ. ગુપ સ્થાપક ઘનશ્યામ પટેલે સ્વાગત કર્યું. ગાયક વૃંદ ના ૧૪ જેટલા કલાકારોએ પુરાને નગમેના મશહૂર હિન્દી ફિલ્મોના ગીતો રજૂ કર્યા. એન્કર તરીકે ગોપાલ શાહ, સ્તૃતિ શાહ અને રમેશભાઈ બખાઈ ની સેવા સરાહનીય રહી.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી મિટીંગ યોજાઇ



કઠલાલના શિવ આશિષ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગ માં ખેડા જીલા પ્રમુખ ઈશ્વરસિંહ પરમાર ની સાથે ખેડા જિલા લિગલ સેલના સુનીલર્સિલ ઠાકોર અને બાલાસિનોર તાલુકા પ્રમુખ કિરીટસિલ ઝાલા તથા નટવરસિંહ બારૈયા તથા ગામ સમિતિ ના પ્રમુખો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સંગઠનને મજબૂત બનાવવા તેમજ સમાજને કેવી રીતે ઉપયોગી થવાય તેવા કાર્યો કરવા જેવી બાબતની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.તેમજ સમાજમાં શિક્ષણ વધે અને સમાજ વ્યસન મુક્ત થાય તે બાબતે પણ યર્ચાઓ કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં ગુજરાત ક્ષત્રિય સેનાના હોંકેદારો અને કાર્યકરો અ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

નાપાડ જૈન દેરાસર ખાતે પર્યુષણ મहાપર્વની ઉજવણી

નાપાડ ખાતેના મુનિ શ્રી સ્વામી જૈન દેરાસર ખાતે પર્યુષણ મહા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જ્યાં આજે સવારે પ્રભાની પૂજા બાદ બપોરે પંચ કલ્યાણક પજા અને સાંજે સંધ્યા ભક્તિ કરવામાં આવી હતી. આ નિમિત્તે મુનિ પાશવ ભક્તિ ભવનમાં સામુહિક એકાકરણ કરવામાં આવ્યું હતું.અને ભગવાનને આંગી અર્પણ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં જેન



આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પડતર પ્રશ્નો અંગે રેલી યોજી આવેદન આપશે

ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઘટકના શિક્ષકોએ જુની પેન્શન યોજના સહિત એન્ય પડતર પ્રશ્નો અંગે આગામી તાઃ૦૩/ ૦૯/૨૦૨૨નાં રોજ જિલ્લા કક્ષાએ વિરોધ સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનું કાર્યક્રમ યોજ્યો છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લાના શિક્ષકો

વ્યાયામ શાળા મેદાન થી સભા રેલી યોજવામા આવશે.જ્યાંથી શાસ્ત્રી મેદાન થી ગુરૂદ્રારા સર્કલ થઇ અમુલ ડેરી, ગણેશ ચોકડી રેલી કરવામાં આવશે અને જિલા કલેકટર કથેરીએ દરેક તાલુકાના પ્રમુખ, મહામંત્રીઓ, હોદેદારો હોજર રહી આવેદન સુપ્રત કરશે,એમ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિક્રમસિંહ ગરાસીયા દ્વારા

નલિની આર્ટસ કોલેજમાં પ્રેમચંદ તેમજ મૈથિલીશરણ ગુપ્ત જયંતી



યારતર વિદ્યા મંડળ સંચાલિત નલિની-અરવિંદ એન્ડ ટી.વી.પટેલ આર્સ કોલેજના હિન્દ્રી વિભાગ દ્વારા કોલેજ ના આચાર્યશ્રી ડો. બી. એમ. પરમારની અધ્યક્ષતામાં પ્રેમચંદ જયંતી તેમજ રાષ્ટ્રવિ મૈધિલીશરણ ગુપ્તની જયંતિની ઉજવણી સંપન્ન થઈ.

હિન્દી વિભાગ ના અધ્યક્ષ ડો. બી. એમ. ઝાલાએ સોનું સ્વાગત તેમજ પ્રસંગિક ઉદ્દબોધન કરી કથા સમ્રાટ પ્રેમચંદના સાહિત્યની વિશેષતાઓ નો ખ્યાલ આપ્યો. કોલેજ મધ્યસ્થ સમિતિના વાઈસ પ્રેસિડનટ ડો. એમ. એસ. પરમારે સાહિત્ય સમાજ નું દર્પણ છે તેમ કહી સાહિત્યન યુત્ર પ્રવર્તન વિશે ખ્યાલ આપ્યો હતો. ડો. ધનંજય ચીહાણે કથા સમાટ પ્રેમચંદના સાહિત્યની વિશેષતા તેમજ ખડીબોલીના મહત્વપર્ણ રાષ્ટ્રીય કવિ મેથિલીશરણ ગુપ્તની કાવ્યગત વિશેષતાઓ જણાવી હતી. સદર કાર્યક્રમમાં હિન્દી વિભાગના કુલ વિદ્યાર્થીઓએ કલમના સિપાહી પ્રેમચંદ તથા રાષ્ટ્રકવિ મૈધિલી શરણ ગુપ્રના સાહિત્યના વિવિઘ વિષયો પર સંશોધન પત્ર રજૂ કર્યા હતા.

ડો. ભરતસિંહ ઝાલા, સંચાલન કુ. આરતી મકવાણા તેમજ આભાર દર્શન ડો ધનંજય ચૌહાણે એ કર્યું.

જાહેર આમંત્રણ

આથી તમામ ધર્મપ્રેમી સક્રકનોને જાહેર આમંત્રણ પાઠવતાં હર્ષ અને લાગણી સહ જણાવવાનું કે જાગનાથ હ્ટાંદેવ મંદિર, આણંદ ખાતેથી શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના નિર્વાણ પીઠાધીયાર આચાર્ય મહામંડલેયાર રાજગુરુ સ્વામી વિશોકાનંદ ભારતી મહારાજથી ચાતુમાંત્રના સ્વાધાય અને પ્રવયનનો લાભ આયર્ચ મહારાંડલેશ્વર છો, જે તારીખ ૧૮/૦૯/2૦૦૦ આપી ત્યાં

છો. જે તારીખ ૧૦/૦૯/૨૦૨૨ સુધી લાભ લઈ શકશો. પરંતુ શ્રાવણ માસના છેલા દિવસે તા. ૨૭/૦૮/૨૦૨૨ નારોજ ''હોમાત્મક લયુડ્ર પક્ષ' ઘશે. જેની પૂર્ણાહૃતિ શ્રીકળ હોમાત્મક લિધિ સાંજે ૦૫:૩૦ કલાકે થશે તથા તારીખ ૦૧/૦૯/૨૦૨૨ના રોજથી પંચાયની અખાડા મહાનિર્વાણીના નિર્વાણ પીઠાપીચર

આચાર્ય મહાબંડલેશ્વર રાજગુરુ સ્વામી વિશોકાનંદ ભારતી મહારાજશ્રીની સાનિધ્યમાં શ્રીમદ દેવીભાગવત

આવા પાવનકારી પ્રસંગે અનેક ધર્મના મહેતો, સાધુઓ, સંતો તથા બ્રાહ્મણો પધારશે. આવા વિરલ ધાર્મિક પ્રસંગે આપ સર્વે મિત્ર મેડળ સહિત દર્શનનો લાભ લેવા અવશ્ય પધારશો, એવી મહારાજક્રી શુભમપુરીજી

મહાપુરાણ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે જેનો સમય બપોરે ૨ થી ૬ નો રહેશે.

આણંદ ખાતે વર્લ્ડ ફિટનેસ ફેડરેશન દ્વારા મિસ્ટર ગુજરાત ચેમ્પિયન સ્પર્ધા યોજાશે

વર્લ્ડ ફિટનેસ ફેડરેશન દ્વારા આયોજિત રાજ્ય લેવલની આણંદ ખાતે મિસ્ટર ગુજરાત ચેમ્પિયન સ્પર્ધા યોજાનાર છે. જેમાં જુદી જુદી શ્રેણીમાં યુવક યવતીઓ ભાગ લઈ શકશે.મિસ્ટર ગુજરાત સ્પર્ધા આગામી તા. ૨૮/૦૮/૨૦૨૨ ,રવિવાર ના રોજ આણંદ ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય કક્ષાની WFF સ્પર્ધા યોજાશે.જેમાં વિનર બનેલ સ્પર્ધકને પુરસ્કાર આપવામાં આવશે અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં આગળ ધપાવવામાં આવનાર હોવાનું.આયોજક સુશીલ કુમાર પ્રમુખ ગુજરાત WFF દ્વારા જણાવાયું છે.

મિસ્ટર ગુજરાત સ્પર્ધામાં જોડાવવા ઇચ્છુક ૨૩ વર્ષીય



યુવક અને યુવતીઓએ આણંદ વિદ્યાનગર લક્ષય સ્પોર્ટ્સ ફિટનેસ, ત્રિવેણી આરકેડ ખાતે 3.9400 ફી ફરી નામાંકન કરાવવં કરજિયાત છે.જેમાં જમ કરતા.જમનેસ્ટિક.રમત ગમત સાથે જોડાયેલા યુવકો અને યવતિઓ ભાગ લઈ શકશે. ઉદ્યોખનીય છ**ે**કે, સ્ટેટ ચેમ્પિયન સર્પર્ધાનું આ આણંદ ખાતે કરાવી લીધો છે.

બીજો કાર્યક્રમ છે.જેમાં અગાઉ ૧૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.આ અંગે મેડીટેશન ના ડો. પલક વર્માએ જણાવ્યું હતું કે, સ્પર્ધા માટે વોકિંગ અંગેની તાલીમ અને શરીર શેષ્ઠવ અંગેની જાણકારી આપવામાં આવશે. હાલ આ સ્પર્ધામાં ૭૦ જેટલા લોકોએ રજિસ્ટ્રેશન

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઇ

આણંદ સ્થિત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં ટસ્ટ સંચાલિત બી.એન.પટેલ કોલેજ ઓક ક્રિઝીયોથેરાપી કોલેજની વિદ્યાર્થીની કુ. સીમર કોર રાયોતના શુભ હસ્તે દવજવંદન કરવામાં આવ્યં

આ કાર્યક્રમમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેઝીંગ રૂસ્ટી અને સેક્રેટરી ડૉ. . બીખુભાઇ એન. પટેલ, જોઇન્ટ સેક્રેટરી શ્રીમતી મૃદુલાબેન બી. પટેલ, જોઇન્ટ સેંક્રેટરી અન્વેશ પટેલ, ટ્રસ્ટી રાકેશભાઇ શાહ, તેમજ ટ્રસ્ટ સંચાલિત વિવિધ સંસ્થાઓના આચાર્ય ડિરેકટર, અધ્યાપકો અને દરેક સંસ્થાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

બી.એન.પટેલ કોલેજ બોક હિઝીપોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તદઉપરાંત બી. એન. પટલ ઇન્સ્ટીટપૂટ ઓફ પેરામેડીકલ એન્ડ સાયન્સ (પેરામેડીકલ વિભાગ)ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિત ગીતની પસ્તુતી કરવામાં આવી હતી. મહેમાનો દ્વારા ત્રિરંગી કુગ્ગા આકાશમાં

છોડાયા હતા.

GMM-Pfaudler ¹

GMM PFAUDLER LIMITED

વૈડિયો કોન્ફરન્સિંગ (વીસી)/અઘર ઓડિયો વિઝ્યુઅલ મીન્સ (ઓએવીએમ થકી યોજાનારી પલ્મી વાર્ષિક સાધારણ સભા સંબંધમાં માફિતી

https://instavote.linkintime.co.in પર ઉપલબ્ધ થશે.

ામિકાલ સરનામાં નોંધણી / અદ્યતન કરવાની રીત :

- ાર સરકામાં નિવિધા? અંધાના કરવાની દીવ : પ્રત્યાસ માત્રામાં છે છે. સંચાયતા કોમ પણ તેમાની ઇ-વેઇટર અલાંદી કંપની પાસે નીંધાથી નહીં કોમ તેવા સમગો દિવ <u>સંઘાદમાં / web inisintime.co.in/</u> EmailReg/Email Register from નો ઉપયોગ સંદેશે કંપનીના વર્ષિયુટ્ટ એક્ટ કરે ટ્રસ્ટાલ્ટ સમ્મેન્ટર સ્થિત કંપની પાસે તેવાના કરી કંપની પાસે કંપની પાસે કંપની કંપની પાસે કંપની કંપની પાસે કંપની કંપની કંપની કંપની પાસે કંપની કંપ
- નાયાવ્યા શકા છે. કીપટીરિયાદાઇગુંઠ માદ્યમમાં શેરી ધરાવતા સભ્યોને તેમના સુશંગ કિપોબિસ્ટરી સહભાગીઓ પાસે તેમનાં ઇં–ચેઇસ સરનામાં નોંધાવવાની, અંધતન કરવાની વિનંતી છે. ક્લોપમાં વેક્ટિંગની પદઘતિ :

જાવમુક્તભવા પાસ્ટનમાં પ્લાવના અમેલા બધા કરાવો પર તેમના વીટ આપવા તેમા બધા કંપલાસકોને રિમોટ ઇ-વોટિંગ સુવિધા ("મિમોટ ઇ-વોટિંગ") પૂર્ણ પાકી રહી છે. રોયલાસકોને બેઝુએમ દરમિયાના રિમોટ ઇ-વોટિંગ સુવિધા રહેવા ને પોટિંગનો પહોંચાન કહીને કોંગ્ય કરાવો પર તેમના રો આપનાની નિવસ પરો ને બેઝુએમ દરમિયાન રિમોટ ઇ-વોટિંગ/ઇ-વોટિંગ માટે વિગતવાર પ્રક્રિયા એછ્સેમની

- ોએ નોંધ લેવી જોઈએ કે કંપનીના બોર્ડ ઓફ કાયદેક્ટરોએ ૨૫:
- લાંદાલીકુલ સરનામેં મોકલવામાં આવશે. દેશાંદાલીએ વાકેક કોવું જરૂરી છે કે આવકવેટા લાટ ૧૯૬૧, ભાણાં લાટ ૧૯૧૦ હતા સુધારામાં અનુસાર, કંપની હતા ૧ એપ્લિલ, ૧૦૧૨ પછી ચૂકવામાં અભ્યા વિભાગ કરવામાં આવતાં હિલિએ દોશાંદાલોમાં કાર્યો કરપામ રહે એ અને કંપનીએ દિલિએકમાંથી ચૂકર દરે કરતા એટ સોર્સ (ટીલેએક) કાર્યો લેવાનું આત્માનક રહેશે. ટીકીએક ૧૨ દેશાંદાલોની વિભાગી દિલ્લીએ અને તેમના હાર સુપાર દરભાગેંગો અને કંપની હારા સ્વીલકારોલા દરભાગેંગો આવારે બિલ્લ રહેશે. આ પુષ્પ આપણી દિલિએક અની સમાનાના અનુસાર ટીલેએલ કાર્યો લીધા પાર્ચી પ્રમુખામાં આવશે.

ધારકોને આવકવેશ ધારા ૧૯૬૧ની લાગુ જોગવાઈએ અનુસાર દસ્તાવેજો સુ વાની વિનંતી છે. લાગુ કર દરો ઉપલબ્ધ કરવા આવશ્યક વિગતવાર કર

દસ્તાયેજો એજીએમતી સૂચનામાં આપવામાં આવશે. બેન્ક વિગતોની નોંધણી / અઘતન કરવાની પધ્ધતિ :

- ડીમટીરિચલાઈફ્રક માધ્યમમાં શેરો ધરાવતા શેરધારકોને તેમની સંબંધિ કિપોબ્રિટરી સફભાગીઓ પાસે સંપૂર્ણ બેન્ક ખાતાની વિગતો નોંધાવવાન
- િમની છે.

 પ્રત્યાસ માંદ્રાગમાં શેરો ઘટમાતા અને તેમાની તેમકની પિતાનો લોંઘાવી નાઈ હોય તેમ લે પોતાનો માર્કિયા વેદના શેરા માર્કિયા કે https://web.linkintline.co.in/EmailReg/
 Email Register.html પર લિંગ કરીને અથવા હી-મોંદર / તેમક જિલ્લેશન સમાર્ગ પૂરીને લેમ્પેન્ટર માર્ગિયારિ રેલ ખાતે તેમની વેપસાપાર્ટિ સપ્ત્રમ.linkintline.co.in ક્લિક કરીને તેમાં માર્ગદર્શન અનુસાર નોંધાલી પ્રત્યિમાં પાલલ કરીને લિંક ઇન્દલાઈ ઇન્દિયા આ દિ. પાસે તેનો નોંધાવી કરાવી શકે છે. "મે કોઈ મૂંત્રવાળા કીચ તો સમારો માર્ગ્યારે મોન્દ mt.helpdesidelinkintline.co.in. પર ઇન્દિલ મોન્દલી શકે છે.

ઉંકત માહિતી કંપનીના બધા શેરધારકોની માહિતી અને લાભ માટે અને એમસીએ અને સેબી દ્વારા જારી પરિપઝક(કો) ઠેઠળ જારી કરવામાં આવી છે.

જીએમએમ ફોકલર **લિમિટેક** વર્તી સર્દી/-ાંગરાલ મફતા કંપની સેકેટરી અને કોમ્પ્લાયન્સ ઓફિસા

તારીખ : ૨૫ ઓગસ્ટ, ૨૦૨૨

૫.પુ. મહંત શ્રી ૧૦૮ શ્રી શુભમપુરીજી મહારાજ ગુર શ્રી રમેશપુરીજી મહારાજ તથા સર્વ ભક્તજનોશ્રી જાગનાથ મહાદેવ, આણંદ